

બુકિંગ એગ્રીમેન્ટ (બાનાખતનો કરાર)

રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ - ૨ (વાડજ) સાબરમતી તાલુકાના મોજે - વાડજ ગામની સીમના સર્વે નંબર : ૩૯૪ / ૧ / ૧ ની કુલ ચો.મીટર : ૨૬૮૧ ની જમીન કે જેનો ટી.પી.સ્કીમ નંબર : ૨૮ માં સમાવેશ કરીને ફાળવેલ ફાઈનલ પ્લોટ નંબર : ૮૪૩ / ૧ ની ચો.મીટર : ૧૪૭૪ ની રહેણાંકના હેતુ માટેની તથા ચો.મીટર : ૧૩૫ ની વાણિજ્ય હેતુ માટેની એમ મળી કુલ ચો.મીટર : ૧૬૦૯ ની બિનખેતીની જમીન ઉપર “ **આદિત્ય આઈકોન** ” ના નામથી ફ્લેટો / દુકાનોનું બાંધકામ કરવામાં આવનાર છે, તેમાં આવેલ મીલકત અંગે બાનાખતનો કરાર.

અમો / વેચાણ આપનાર - લખી આપનાર - એકતરફવાળા :-

⇒ આદિત્ય કોર્પોરેશન **PAN : ABCFA 8352 J**
એ નામની ભાગીદારી પેઢી કે જેની રજીસ્ટર્ડ ઓફિસ : ઇ.એલ. / ૧૦, ગોકુલ
કોમ્પલેક્ષ, એ-વન સ્કુલની બાજુમાં, મેમનગર, અમદાવાદના સરનામે આવેલ
છે. તેના વતી અને તરફથી તેના વહિવટકર્તા ભાગીદાર :-
હિતેશ પ્રબોધભાઈ પરીખ
(મોબાઈલ નંબર :)
(મેઈલ આઈ.ડી. નંબર :)

જેમને હવે પછી આ બાનાખતના કરારમાં “અમો” અને અગર અમો “વેચાણ
આપનાર - લખી આપનાર - એકતરફવાળા” એ રીતે સંબોધવામાં આવ્યા છે જે શબ્દના
અર્થમાં અમો વેચાણ આપનાર ભાગીદારી પેઢીનો તથા ભાગીદારી પેઢીના હાલના તથા
વખતો વખતના ભાગીદારો તથા ભાગીદારોના વંશ, વાલી, વારસો, એસાઈનીઓ,
એકઝીક્યુટરો તમામનો સમાવેશ થાય છે.

તમો / વેચાણ લેનાર - લખાવી લેનાર - બીજીતરફવાળા :-

⇒ **PAN :**
પુખ્તવયના, ધર્મે : હિન્દુ, રહેવાસી :
.....

જેમને હવે પછી આ બાનાખતના કરારમાં “તમો” અને અગર તમો “વેચાણ
લેનાર - લખાવી લેનાર - બીજીતરફવાળા” એ રીતે સંબોધવામાં આવ્યા છે. જે શબ્દના
અર્થમાં તમો વેચાણ લેનારનો તથા તમો વેચાણ લેનારના વંશ, વાલી, વારસો,
એસાઈનીઓ, એકઝીક્યુટરો, એડમીનીસ્ટ્રેટરો, સકશેસરો, સરવાઈવરો ઈત્યાદી સર્વેનો
સમાવેશ થાય છે.

આ બુકિંગ એગ્રીમેન્ટ અંગેનો લેખ અમો એકતરફવાળા પ્રયોજક અને તમો
બીજીતરફવાળા સભ્ય વચ્ચે નીચેની વિગતો એન શરતો મુજબ કરવામાં આવે છે.

(૧) જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ - ૨ (વાડજ)

સાબરમતી તાલુકાના મોજે - વાડજ ગામની સીમના સર્વે નંબર : ૩૯૪ / ૧ / ૧ ની કુલ ચો.મીટર : ૨૬૮૧ ની જમીન કે જેનો ટી.પી.સ્કીમ નંબર : ૨૮ માં સમાવેશ કરીને ફાળવેલ ફાઈનલ પ્લોટ નંબર : ૮૪૩ / ૧ ની ચો.મીટર : ૧૪૭૪ ની રહેણાંકના હેતુ માટેની તથા ચો.મીટર : ૧૩૫ ની વાણિજ્ય હેતુ માટેની એમ મળી કુલ ચો.મીટર : ૧૬૦૯ ની બિનખેતીની જમીન ઉપર **“આદિત્ય આઈકોન ”** ના નામથી ફ્લેટો / દુકાનોનું બાંધકામ કરવામાં આવનાર છે, તેમાં આવેલ બ્લોક નંબર : ના ફ્લોરનો ફ્લેટ નંબર : વાળી ચો.મીટર : ના કાર્પેટ ક્ષેત્રફળવાળી (રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ - ૨૦૧૬ ના નિયમોનુસાર) મીલકત તથા સદર ફાઈનલ પ્લોટ નંબર : ૮૪૩ / ૧ ની ચો.મીટર : ૧૪૭૪ ની જમીન પૈકી બાંધકામના પ્રમાણમાં વણ વહેચાયેલ ચો.મીટર : ના હક્ક સહિતની મીલકત આ બાનાખતના કરારથી વેચાણ આપવાનું નક્કી કરેલ છે. જેનું સંપૂર્ણ વર્ણન નીચે પરીશીષ્ટમાં આપવામાં આવેલ છે. જેને હવે પછી આ બાનાખતના કરારમાં “સદરહુ મીલકત” એ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

- (૨) મજકુર જમીનને બિનખેતીની મંજૂરી મે.જીલ્લા કલેક્ટરશ્રી, અમદાવાદનાએ તેમના તારીખ : ૧૦-૦૯-૨૦૧૫ ના રોજના હુકમ નંબર : સીબી / જમીન - ૨ / એન.એ. / એસ.આર. - ૯૭૩ / ૨૦૧૫ થી આપેલ છે. જે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં ફેરફાર એન્ટ્રી નંબર : ૨૪૧૧૫, તારીખ : ૧૫-૦૯-૨૦૧૫ ના રોજ કરવામાં આવેલ.
- (૩) સદરહુ સમગ્ર જમીન રેખાબેન અરવિંદભાઈ પટેલ, અશોકકુમાર કરશનભાઈ પટેલ, ચિંતન કનુભાઈ પટેલ, મોહનભાઈ દામોદરદાસ પટેલ, ભાવિન ભાઈલાલભાઈ પટેલ, જીગ્નેશ મહેન્દ્રભાઈ પટેલ, અમીત રમેશચંદ્ર પટેલ, વિમલ નવિનચંદ્ર પટેલ, વિમળાબેન નવિનચંદ્ર પટેલ, માયાબેન દિનેશભાઈ પટેલ, જસ્મીન દિનેશભાઈ પટેલ, દિપકકુમાર કિર્તીકુમાર પટેલ, સંજયભાઈ ભરતભાઈ પટેલ, અશોકભાઈ કરશનભાઈ પટેલ તથા ભરતભાઈ વિઠ્ઠલભાઈ પટેલની માલિકી, કબજા, ભોગવટાની આવેલી અને તેઓની પાસેથી સદરહુ જમીન અમો વેચાણ આપનાર ભાગીદારી પેઢીએ વેચાણ રાખેલ. જે બાબતનો વેચાણ દસ્તાવેજ અમદાવાદ - ૨ (વાડજ) ના મે.સબ - ૨જસ્ટ્રાર સાહેબની કચેરીમાં તારીખ : ૧૨-૦૫-૨૦૧૬ ના રોજ અનુક્રમ નંબર : ૫૯૧૨ થી નોંધવામાં આવેલ. જે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં ફેરફાર એન્ટ્રી નંબર : ૨૪૩૫૧, તારીખ :

૧૯-૦૫-૨૦૧૬ ના રોજ કરવામાં આવેલ. જે નોંધ તારીખ : ૧૧-૦૭-૨૦૧૬ ના રોજ પ્રમાણિત કરવામાં આવેલ. જે વેચાણ દસ્તાવેજમાં સુધારાનો લેખ કરવામાં આવેલ. જે સુધારાનો લેખ અમદાવાદ - ૨ (વાડજ) ના મે.સબ - રજીસ્ટ્રાર સાહેબની કચેરીમાં તારીખ : ૨૨-૦૮-૨૦૧૬ ના રોજ અનુક્રમ નંબર : ૯૯૬૨ થી નોંધવામાં આવેલ. જે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં ફેરફાર એન્ટ્રી નંબર : ૨૪૫૨૪, તારીખ : ૦૬-૦૯-૨૦૧૬ ના રોજ કરવામાં આવેલ.

- (૪) સદર ફાઈનલ પ્લોટ નંબર : ૮૪૩ / ૧ ની કુલ ચો.મીટર : ૧૬૦૮ ની જમીન ઉપર ફ્લેટો / દુકાનોનું બાંધકામ કરવા માટેના પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી તારીખ : ૨૦-૦૧-૨૦૧૬ ના રોજના નીચે મુજબના કેસ નંબરથી મંજૂર કરવામાં આવેલ.

બ્લોક નંબર

કેસ નંબર

A

BLNTI / WZ / 181115 / GDR / A5314 / R0 / M1

(રજીસ્ટ્રી નંબર : 5266 / 181115 / A5314 / R0 / M1)

B

BLNTI / WZ / 181115 / GDR / A5315 / R0 / M1

(રજીસ્ટ્રી નંબર : 5267 / 181115 / A5315 / R0 / M1)

એ રીતેની ઉપર મુજબના કેસ નંબરથી સદરહુ જમીન ઉપર બાંધકામ કરવા અંગેના પ્લાન મંજૂર કરવામાં આવેલ. જે મંજૂર થયેલા પ્લાન મુજબ રહેઠાણના ફ્લેટો તથા વાણિજ્યની દુકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે, સદરહુ સમગ્ર જમીન બિનખેતીની અને બાંધકામ યોગ્ય બનેલ તેમજ સદર સ્કીમમાં મંજૂર થયેલ પ્લાન અને લાગુ ઓથોરીટી દ્વારા આપવામાં આવેલ નિયમાનુસાર / નાગરીક આધાર રૂપ જરૂરીયાત મુજબ પાણી, ગટર અને વિજળી સહિતની લખી આપનારે નક્કી કરેલ અને જણાવ્યા મુજબ જરૂરી સુવિધાઓયુક્ત બાંધકામ કરવા / કરાવવાની યોજના અમલમાં મુકેલ છે.

- (૫) સદરહુ મીલકત ઉપર કોઈ સંસ્થા, બેંક, પેઢી, શ્રોફ, વ્યક્તિઓ, સરકારશ્રીનો કે ગ્રામ પંચાયત કે સ્થાનિક સંસ્થાઓનો વિગેરે કોઈનો બોજો કે કોઈ લોન નથી કે કોઈના જમીનમાં નથી. તેમજ કોઈ કોર્ટ કચેરી કે ઓફિસોમાં કોઈપણ જાતના કેસો કે પ્રોસેડિંગ્સ ચાલતા નથી કે કોઈ હુકમનામું થયેલ નથી. સદર મીલકતમાં કોઈપણ જાતના રીઝર્વેશન કે કપાતમાં નથી કે ગ્રીન બેલ્ટમાં નથી. તેમજ તેના ઉપર કોઈનો ભરણ પોષણનો કે અન્ય કોઈ હક્ક પોષાતો નથી તેમજ કોઈને

કોઈપણ પ્રકારના લખાણોથી લખી આપેલ નથી. કોઈને કબજો સોપેલ નથી. તેવી તમામ પ્રકારના રાઈટ ટાઈટલ્સ ચોખ્ખા અને મોર્કેટેબલ હોવા અંગેની તમામ ખાતરીઓ અમો આપીએ છીએ. જે અંગેનું ટાઈટલ સર્ટીફિકેટ એડવોકેટશ્રી શરદ એન. દરજીએ તારીખ : ૦૯-૦૯-૨૦૧૬ ના રોજ આપવામાં આવ્યું છે.

- (૬) સદરહુ સમગ્ર જમીન ઉપર જે રહેણાંકના ફ્લેટો તથા વાણિજ્યની દુકાનોનું બાંધકામ કરવામાં આવેલ છે. તે બાંધકામવાળી મીલકત “ આદિત્ય આઈકોન ” એ નામથી ઓળખાશે અને સદરહુ નામમાં ફેરફાર કરવાનો તમો લખાવી લેનાર - બીજીતરફવાળાને કોઈ હક્ક કે અધિકાર નથી.
- (૭) સદરહુ જમીનમાં મંજૂર થયેલા પ્લાન તથા રજાચીટ્ટી મુજબ એપાર્ટમેન્ટ ટાઈપના રહેણાંકના ફ્લેટો તથા વાણિજ્યની દુકાનોના બાંધકામની યોજના નિયમ બધ્ધ અમો વેચાણ આપનાર - એકતરફવાળા આદિત્ય કોર્પોરેશન એ નામની ભાગીદારી પેઢી દ્વારા મુકવામાં આવેલ છે અને સદર જમીન અમો લખી આપનાર - એકતરફવાળાની માલિકી, કબજા, ભોગવટાની બોજા રહિત મીલકત આવેલ છે.
- (૮) સદરહુ સમગ્ર જમીન ઉપર મુકવામાં આવેલ “ આદિત્ય આઈકોન ” નામની યોજનામાં પેરા નંબર : ૧ માં દર્શાવ્યા મુજબની મીલકત તેને આનુસંગિક નીચે મુજબના હક્કો તથા હિતો સહિતની મીલકત ઉચ્ચક અઘાટ વેચાણ કિંમત રૂા..... અંકે રૂપીયા પુરા માટે વેચાણ આપવાનું નક્કી કરેલ છે. જે કિંમતમાં નીચે દર્શાવ્યા મુજબના હક્કો તથા હિતોની કિંમતનો પણ સમાવેશ થઈ જાય છે.

એ :- સદરહુ મીલકતની આનુસંગિક બાલ્કની નંગ - ૧ ની ચો.મીટર : ના કાર્પેટ ક્ષેત્રફળવાળી મીલકતની કિંમતનો કુલ નક્કી કરેલ અવેજની રકમમાં સમાવેશ થઈ ગયેલ છે.

બી :- સદરહુ મીલકતને આનુસંગિક વોશ એરીયા નંગ - ૧ ની ચો.મીટર : ના કાર્પેટ ક્ષેત્રફળવાળી મીલકતની કિંમતનો કુલ નક્કી કરેલ અવેજની રકમમાં સમાવેશ થઈ ગયેલ છે.

એ રીતે ઉપર મુજબના પેરા નંબર : ૮ / એ તથા ૮ / બી માં દર્શાવ્યા મુજબના

ક્ષેત્રફળનો કુલ કાર્પેટ એરીયા ચો.મીટર : માં સમાવેશ થયેલ છે.

- (૯) સદરહુ મીલકત અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકએ તમો એલોટી સભ્યને ઉપર દર્શાવ્યા મુજબ અઘાટ વેચાણ કરવાનું નક્કી કરેલ છે. તે પૈકી નીચે મુજબની વિગતે તમો વેચાણ લેનારે બાનાપેટેની રકમ ચુકવી આપેલ છે.

રૂા.

રૂા.

રૂા..... અંકે રૂપીયા પુરા.

એ રીતે ઉપર મુજબની વિગતે અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકોને તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્યએ આજ અગાઉ ચુકવેલ છે તે પૈકી બાકી રહેતી અવેજની રકમ નીચે મુજબના હપ્તા, તારીખ અને ટકાવારી પ્રમાણે ચુકવવાનું તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્યએ માન્ય અને કબુલ રાખેલ છે.

<u>હપ્તો</u>	<u>રકમ</u>	<u>તારીખ</u>	<u>ટકાવારી</u>
પહેલો			
બીજો			
ત્રીજો			

- (૧૦) સદર મીલકતની ઉપરોક્ત નક્કી કરેલ હપ્તા અને તારીખ પ્રમાણે અવેજની રકમ ચુકવવામાં વિલંબ થાય તો તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્યને અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજક રજીસ્ટર્ડ પોસ્ટ થી કે ઇ - મેઈલથી બાકી રકમ ચુકવવાની નોટીસ આપીશુ અને તમો લખાવી લેનાર - બીજીતરફવાળા

સભ્ય આપેલ નોટીસનો યોગ્ય જવાબ કે બાકી રહેતી રકમ ૧૫ દિવસની મુદતની અંદર ચુકવવામાં કસુર કે વિલંબ કરશે તો તમો એલોટી સભ્યએ ત્યારબાદ બાકી રહેતી અવેજની રકમ ઉપર ૧ (એક) ટકા લેખે માસિક વ્યાજ ચુકવવાનું રહેશે. તે શરત તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્યએ કબુલ અને માન્ય રાખેલ છે.

- (૧૧) સદરહુ મીલકતનું વપરાશ અંગેનું સર્ટીફિકેટ લાગુ ઓથોરીટી પાસેથી આશરે ની સાલમાં આવશે અને સદર મીલકતનું વપરાશ અંગેનું સર્ટીફિકેટ આવે તેની જાણ અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકોએ તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્યને ૭ દિવસમાં કરવાની રહેશે. પરંતુ જો કુદરતી આફત, આગ, ધરતી કંપ કે અન્ય કોઈ કુદરતી કે માનવસર્જિત સંજોગોમાં કે સરકાર દ્વારા કાયદાકીય કલમોમાં ફેરફાર થવાથી પઝેશન આપવામાં વિલંબ થાય તો તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્યએ માન્ય અને કબુલ રાખવાનું રહેશે અને તે અંગે કોઈપણ પ્રકારની તકરાર કરવા / કરાવવાની નથી.
- (૧૨) સદરહુ મીલકતનું પઝેશન અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકે તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્યને આશરે ની સાલમાં આપવામાં આવશે. પરંતુ સદર મીલકતનું વપરાશ અંગેનું સર્ટીફિકેટ આવવામાં વિલંબ થાય તો પઝેશન આપવાની મુદતમાં આપોઆપ વધારો થશે જે તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્યએ કબુલ અને માન્ય રાખવાનો છે અને રહેશે.
- (૧૩) સદર મીલકત નક્કી કરેલ મુદતમાં પઝેશન આપવામાં ઉપરોક્ત જણાવેલ કારણ સિવાય અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકોને લીધે પઝેશન આપવામાં વિલંબ થાય તો તમો લખાવી લેનાર - બીજીતરફવાળાએ ચુકવેલ અવેજની રકમ ઉપર ૧ (એક) ટકા લેખે માસિક વ્યાજ અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકએ ચુકવવાનું રહેશે.
- (૧૪) અમો લખી આપનાર - એકતરફવાળા સદર મીલકત તમો લખાવી લેનારને આજ રોજથી વેચાણ આપીએ છીએ અને આથી અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકએ સદર મીલકત ગીરોમાં કે જામીનમાં મુકવાની નથી કે તેના ઉપર કોઈપણ લોન લેવાની નથી કે મીલકતની વેલ્યુ ઘટે તેવા કાર્યો કરવા /

કરાવવાના નથી તે અંગેની બાંહેધરી અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજક તમો લખાવી લેનારને આપીએ છીએ.

(૧૫) અમો એકતરફવાળા પ્રયોજકો અને તમો બીજીતરફવાળા સભ્ય બંને સાથે મળીને એકબીજાની પરસ્પર સમજુતીથી આ બુકિંગ એગ્રીમેન્ટની શરતમાં ફેરફાર કરી શકશે.

(૧૬) અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકોએ “ આદિત્ય આઈકોન ” નામની સ્કીમની જમીન ઉપર અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના મંજૂર થયેલ પ્લાન મુજબ બાંધકામ કરવાનું છે અને તે મંજૂર થયેલ પ્લાનમાં ફેરફાર કરવાનો થાય તો અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજક અને તમો લખાવી લેનાર - બીજીતરફવાળા સભ્ય સાથે મળીને એકબીજાની પરસ્પર સમજુતીથી બાંધકામમાં સુધારો વધારો કરી શકશે. પરંતુ અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકો દ્વારા આયોજીત સદર સ્કીમના સ્પેશીફીકેશન અને પ્લાન કે બિલ્ડીંગના બાંધકામ બાબતે કોઈપણ પ્રકારના સુધારા વધારાઓ નિયમોનુસાર કરવા કરાવવાની જરૂરીયાત ઉદભવે તેમાં તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્યની મુક્ત અને કાયમી સંમતી છે અને રહેશે.

(૧૭) સદરહુ ફાળવેલ / વેચાણ આપેલ મીલકતને લઈને અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજક અને તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્ય વચ્ચે કોઈપણ પ્રકારનો વિવાદ કે તકરાર ઉપસ્થિત થાય તો બંને એકબીજા સાથે મળીને પરસ્પર સમજુતીથી ઉપસ્થિત થયેલ વિવાદ કે તકરારનો ઉકેલ લાવવાનો રહેશે. તેમ છતાં તે વિવાદ કે તકરારનો ઉકેલ ન આવે તો રેરા એક્ટ - ૨૦૧૬ ની ઓથોરીટીના નિતી નિયમો મુજબ ઉકેલ લાવવાનો રહેશે.

(૧૮) સદર ફાળવેલ / વેચાણ આપેલ મીલકતની બાંધકામમાં સ્ટ્રક્ચર ખામી અથવા વર્કમેનશીપની અથવા માલ - સામાનની ગુણવત્તા અથવા સેવાની જોગવાઈ બાબતે કે ડેવલપમેન્ટ સંબંધે કે બુકિંગ એગ્રીમેન્ટની સમજુતી મુજબ અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકના અન્ય બંધનો - ફરજો અંગેની ખામી તમો લખાવી લેનાર - બીજીતરફવાળા એલોટી સભ્ય દ્વારા કબજો સોંપ્યાની તારીખથી વર્ષ - ૫ ના સમયગાળાની અંદર અમો એકતરફવાળા પ્રયોજકોની જાણકારીમાં લાવવામાં આવે તો અમો લખી આપનાર - એકતરફવાળા પ્રયોજકોની ફરજ બનશે કે ૩૦ દિવસની અંદર વધારાનો ચાર્જ વસુલ કર્યા સિવાય એવી ખામીઓ

સુધારી આપવાની રહેશે. પરંતુ સદરહુ મીલકતમાં વેચાણ લેનાર પોતે કે પોતાના પ્રતિનિધી મારફતે સ્ટ્રકચર કે તેના મુળભુત ફીટીંગ્સમાં કોઈપણ ફેરફાર કે તોડફોડ કરાવે અને તેથી કરીને બિલ્ડીંગ કે ફીટીંગ્સમાં ખામી સર્જાય તો તે અંગે વેચાણ આપનાર - એકતરફવાળાને જવાબદાર ગણી શકાશે નહિ અને તેવા સંજોગોમાં તેવી કોઈ ગેરંટી કે બાંહેધરી અમલી ગણાશે નહિ.

-: પરિશિષ્ટ :-

રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ અમદાવાદ સબ-ડીસ્ટ્રીક્ટ અમદાવાદ - ૨ (વાડજ) સાબરમતી તાલુકાના મોજે - વાડજ ગામની સીમના સર્વે નંબર : ૩૯૪ / ૧ / ૧ ની કુલ ચો.મીટર : ૨૬૮૧ ની જમીન કે જેનો ટી.પી.સ્કીમ નંબર : ૨૮ માં સમાવેશ કરીને ફાળવેલ ફાઈનલ પ્લોટ નંબર : ૮૪૩ / ૧ ની ચો.મીટર : ૧૪૭૪ ની રહેણાંકના હેતુ માટેની તથા ચો.મીટર : ૧૩૫ ની વાણિજ્ય હેતુ માટેની એમ મળી કુલ ચો.મીટર : ૧૬૦૯ ની બિનખેતીની જમીન ઉપર “ **આદિત્ય આઈકોન** ” ના નામથી ફ્લેટો / દુકાનોનું બાંધકામ કરવામાં આવનાર છે, તેમાં આવેલ બ્લોક નંબર : ના ફ્લોરનો ફ્લેટ નંબર : વાળી ચો.મીટર : ના કાર્પેટ ક્ષેત્રફળવાળી (રીયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલોપમેન્ટ એક્ટ - ૨૦૧૬ ના નિયમોનુસાર) મીલકત તથા સદર ફાઈનલ પ્લોટ નંબર : ૮૪૩ / ૧ ની ચો.મીટર : ૧૪૭૪ ની જમીન પૈકી બાંધકામના પ્રમાણમાં વણ વહેચાયેલ ચો.મીટર : ના હક્ક સહિતની મીલકત.

“ આદિત્ય આઈકોન ” ના ખુંટચારની વિગત :-

પૂર્વ :- સર્વે નંબર : ૩૯૪ / ૧ / ૨
પશ્ચિમે :- સર્વે નંબર : ૩૯૪ / ૧ / ૨
ઉત્તરે :- સર્વે નંબર : ૩૯૩
દક્ષિણે :- ૧૮ મીટરનો ટી.પી.રોડ

વેચાણ આપવાનું નક્કી કરેલ મીલકતના ખુંટચારની વિગત :-

પૂર્વ :-
પશ્ચિમે :-
ઉત્તરે :-
દક્ષિણે :-

એ રીતેના નંબરોમાપ તથા ખુંટચાર વચલી મીલકત.

એ રીતેનો ઉપર મુજબનો આ બાનાખતનો કરાર અમો વેચાણ આપનારે તથા

તમો વેચાણ લેનારે રાજીખુશીથી તથા અક્કલ હોંશીયારીથી વાંચી, સમજી, વિચારીને કોઈના કોઈપણ જાતના દાબ દબાણ વગર, બિનિકેફે, તંદુરસ્ત સ્થિતિમાં કરેલ છે, જે અમો વેચાણ આપનારને તથા અમો વેચાણ આપનાર ભાગીદારી પેઢીના હાલના તથા વખતો વખતના ભાગીદારો તેમજ ભાગીદારોના વંશ,વાલી, વારસો, સક્સેશરો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમીનીસ્ટ્રેટરો તેમજ તમો લખાવી લેનારને તથા તમો લખાવી લેનારના વંશ,વાલી, વારસો, સક્સેશરો, એસાઈનીઓ, એક્ઝીક્યુટરો, એડમીનીસ્ટ્રેટરો ઈત્યાદી તમામને કબુલ, મંજૂર અને બંધનકર્તા છે અને રહેશે, અમદાવાદ મધ્યે આજ તારીખ : - -૨૦૧૭ ના દિને.

(અમો / વેચાણ આપનાર - લખી આપનાર - એકતરફવાળા)

⇒ આદિત્ય કોર્પોરેશન
એ નામની ભાગીદારી પેઢીના
વતી અને તરફથી તેના
વહિવટકર્તા ભાગીદાર :-
હિતેશ પ્રબોધભાઈ પરીખ

(સાક્ષીઓ)

૧ _____

૨ _____